

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦,૨૫૬૩૦૨૦૦,૨૫૬૩૦૩૦૦,૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૫/૮/૨૦૧૫ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

શહેર પોલીસ ધ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી:-

સમાચાર યાદી નં.૧૫૭૨/૧૫

દેશી દારૂમાં કેમીકલ થી મુંબઇ માં લક્ષ્યાંક થયેલ જેમાં ૧૨૦ લોકો મરણ ગયેલ જે ગુન્હાનાં કામે નાસતો ફરતો આરોપીની ધરપકડ કરતી અમદાવાદ શહેર કાઈમ બ્રાન્ચ

૧. મે.પોલીસ કમિશ્નર શ્રી અમદાવાદ શહેર નાઓએ તા.૦૪/૦૮/૨૦૧૫ થી તા.૨૦/૦૮/૨૦૧૫ સુધી નાશતાં ફરતાં આરોપી પકડવાની ડ્રાઇવ રાખેલ હોય જે અનુસંધાને કાઈમ બ્રાન્ચ મદદનીશ પો.કમિ શ્રી, કે.એન.પટેલ તેમજ પો.ઇ એસ.આર.ટંડેલ નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ પો.સબ.ઇન્સ, શ્રી જે.એન.ચાવડા તેમજ શ્રી આર.એસ.સુવેરા તેમજ સ્ટાફનાં માણસો અમદાવાદ શહેર વિસ્તારમાં નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓની તપાસ કરવા પેટ્રોલીંગ નિકળેલા હતા. દરમિયાન સાથેના પો.કોન્સ. મહેશભાઈ લલજીભાઈ તથા પો.કોન્સ. કેતનકુમાર દલજીભાઈ નાઓની સંયુક્ત બાતમી હકિકત આધારે વિશ્વકર્મા મંદિર પાસે, ગોતા, અમદાવાદ ખાતેથી મુંબઇ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.-૭૧/૨૦૧૫ ઇપીકો કલમ ૩૦૨, ૩૦૭, ૩૨૮, ૧૧૪, ૧૦૮, ૨૦૧, ૧૨૦(બી), વિગેરે મુજબના ગુન્હાના કામે ભરતભાઈ પ્રહલાદભાઈ પટેલ ઉ.વ.૪૨ ધંધો. વેપાર રહે. બી/૪૦૫, ધરતી-૧ એપાર્ટમેન્ટ, પંચવટી બંગલોઝ સામે, આનંદ પાર્ટી પ્લોટની બાજુમાં, ન્યુ રાણીપ, અમદાવાદ મુળ ગામ.લાડોલ, નવો માઢ, તા.વીજાપુર જી.મહેસાણા નાઓને તા.૦૪/૦૮/૨૦૧૫ ના ક્લાક ૨૧/૦૦ વાગ્યે પકડી તેની પાસેનાં મોબાઇલ ફોન, એક ડાયરી, ઇલેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ તથા રોકડા નાંણા મળી કુલ્લે રૂ.૧૪,૭૨૦નો મુદામાલ કબ્જે કરી આરોપી મુદામાલ કાગળો મુબઇ કાઈમ બ્રાન્ચને સોંપેલ છે.

૨. અગાઉ વાહનચોરીઓનાં ગુન્હામાં પકડાયેલ આરોપી સંખ્ય ઉર્ફે દીલીપ ઉર્ફે ઠડીયો જ્યતીભાઈ ઉર્ફે કાળુભાઈ જાતે ઠાકોર ઉ.વ.૨૫, રહે. મકાન નં- ૪૨૪૩, નરનારયણ સોસાયટી, દક્ષીણી સોસાયટી પાસે, ગુરુજીબ્રીજ આગળ, મણીનગર, અમદાવાદ વિરુદ્ધ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર શ્રી ના હુકમ ક્રમાંક : પીસીબી/ડીએનએમ/પાસા/૫૧૪/૨૦૧૫ તા.૧૨/૦૭/૨૦૧૫ નાં કામના અટકાયતી નાનો પાસા હુકમ કરેલ હોય જે હુકમની બજવણી કરવાની બાકીમાં હોય અટકાયતી છેલ્લા એક માસથી ભાગતો ફરતો હોય જેને તા.૦૫/૦૮/૧૫ ના પો.સ.ઇ જે.એન.ચાવડા નાઓએ હેડ.કોન્સ હિતેન્દ્રસિંહ ખોડુભા નાઓની બાતમી આધારે જમાલપુર ચાર રસ્તા પાસે થી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવા સારુ જી.આય.ડી.સી વટવા પો.સ્ટે ખાતે સોંપેલ છે.

૩. મણીનગર પોલીસ સ્ટેશનનાં ચૈઇનસ્નેચીંગ તેમજ વાહનચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપી જીતેન્દ્ર રમેશભાઇ કાકડીયા (પટેલ) રહે. એ/૪૦૪, દિવ્યજીવન ફ્લેટ, દિપક હાઇસ્કૂલ પાસે, નિકોલ ગામ, અમદાવાદ મુળ ગામ.વિરડી, તા.ગાળીયાધાર, જી.ભાવનગર. ને તા.૦૫/૦૮/૨૦૧૫ ના રોજ પો.સ.ઇ જે.એન.ચાવડા નાઓએ હેડ.કોન્સ હિતેન્દ્રસિંહ ખોડુભા નાઓની બાતમી આધારે લાલદરવાજા પાસે થી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવા સારુ મણીનગર પો.સ્ટે ખાતે સોપેલ છે.જે આરોપી અગાઉ ખુન/એટીએમચોરી/ ચૈઇનસ્નેચીંગ/વાહનચોરી ઘણા બધા ગુન્હાઓમાં પકડાયેલ છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.